

# નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી

નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના મુખ્ય કેમ્પસ ખાતે  
તળાવ ઉંડા કરવાની કામગીરી માટેનું ટેન્ડર ડોક્યુમેન્ટ



ભરેલ ટેન્ડર ફોર્મ મોકલવાની છેલ્લી તારીખ : ૨૧/૦૫/૨૦૨૨

**--: ટેન્ડર સબંધી વધુ વિગત માટે સંપર્ક :--**

સંશોધન નિયામકશ્રીની કચેરી

નવસારી કૃષિ યુનિવર્સિટી

નવસારી - ૩૮૬૪૫૦

ટેલી. :- ૦૨૬૩૭-૨૮૩૧૬૦

મો. :- ૯૮૭૯૫ ૮૨૮૭૧, ૯૮૭૯૪ ૮૮૨૮૯

**--: કચેરી :--**

સંશોધન નિયામકશ્રીની કચેરી

નવસારી કૃષિ યુનિવર્સિટી

નવસારી - ૩૮૬૪૫૦

(ટેન્ડર નંબર: NAU/DR/01-2022-23)

**પ્રકરણ ૦૧ : NAU/DR/01-2022-23 (Offline Tender) ટુકી મુદતની જાહેરાત.**

નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી ખાતે પિયતની સગવડ ઉભી કરવા માટે મુખ્ય કેમ્પસમાં આવેલ તળાવને ઊંડા કરાવવાની થતી કામગીરી માટે એજન્સી/પાર્ટી ફિક્ષ

કરવા બાબત..

**[NAU/DR/01-2022-23]**

આથી સંબંધકર્તા સર્વેને જણાવવાનું કે, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના મુખ્ય કેમ્પસ ખાતે આવેલ તળાવ ઊંડા કરવાની કામગીરી કરાવવા માટે એજન્સી/પાર્ટી પાસે સીલબંધ કવરમાં ભાવો મંગાવવામાં આવે છે, તો રસ ધરાવતી પાર્ટીઓએ ઉક્ત કામગીરીના તમામ ટેક્ષ સહિતના ભાવો અત્રેની કચેરીને નીચેની વિગતે મોકલી આપવા જણાવવામાં આવે છે.

**Period of Tender (Short Term Notice) : 13/05/2022 to 21/05/2022 18.00 Hrs.**

Last date for submission of Tender Fee, : 21/05/2022 up to 18:00 Hrs.

EMD and other mandatory documents by  
RPAD/ Courier/ Speed post

Tender Fee : Rs. 1,500/-

Earnest Money Deposit (EMD) : Rs. 15,000/-

Security Deposit : Rs. 25,000/-

Tendersubmission/Communication address : **Office of the Director of Research**

Navsari Agricultural University, University  
Bhavan, Eru Char Rasta, Navsari –396 450  
(Gujarat).

E-mail: [dr@nau.in](mailto:dr@nau.in)

Phone No.: 02637-283160

Mobile No: 9879582871, 9879488289

વધુમાં, સદર કામગીરી માટે ભાવો ભરવા માટે આ સાથે જણાવવામાં આવેલ કોઈપણ બાબતે મુંઝવણો જણાય તો રૂબરૂ અત્રેની કચેરીનો સંપર્ક કરી આપની મુંઝવણો અંગે માર્ગદર્શન મેળવી શકો છો.

સદરહુ કામગીરી સામેલ નિયમો, બોલીઓ અને શરતો મુજબ કરવાની રહેશે.

**પ્રકરણ ૦૨: નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના મુખ્ય કેમ્પસ ખાતે તળાવ ઊંડા કરવાની કામગીરી તથા ટેન્ડર અંગેના નિયમો, બોલીઓ અને શરતો.**

૦૧	કાર્યનો અવકાશ (Scope of Work).	
	૧.૧	નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના બાગાયત પોલીટેકનીક હસ્તકના પ્લોટ નંબર: જી-૨૮ ખાતેનું તળાવ ઊંડું કરી માટી કેમ્પસ ખાતેના માસ્ટર પ્લાન વિભાગ-એ, પ્લોટ નંબર-૧૧ અને ૧૨માં માટી પુરાણ પ્રતિ ઘન મીટરના ભાવ મુજબ કરવાની રહેશે. (તળાવ અને પુરાણની જગ્યા વચ્ચેનું અંતર આશરે ૨.૦ કિલોમીટર છે)
	૧.૨	સદર કામગીરી અંગેનું ટેન્ડર ભરવા પહેલા સ્થળ/સાઈટ ચકાસણી કર્યા બાદ ટેન્ડર સાથે સામેલ પત્રકમાં જ ભાવો ભરવાના રહેશે.
	૧.૩	ખોદકામ કરી પુરાણ કરવાનો અંદાજીત જથ્થો ૪૦૦૦ ઘન મીટર
	૧.૪	પુરાણ વાળી જગ્યા સમતળ કરવાની નથી.
૦૨	સમિતિના હકો.	
	૨.૧	સદર કામગીરી માટે કોઈપણ એજન્સી/પાર્ટીનાં ભાવ/ભાવપત્રક સ્વીકારવા કે ન સ્વીકારવા એ અંગેના તમામ હકો સદર કામગીરીની ખરીદ પ્રક્રિયા માટે નક્કી કરવામાં આવેલ સમિતિના રહેશે.
	૨.૨	સદર કામગીરીની ખરીદ પ્રક્રિયા માટે નક્કી કરવામાં આવેલ સમિતિ જ્યારે ઈચ્છે ત્યારે ખરીદ પ્રક્રિયા રદ જાહેર કરી સ્થગિત કરી શકે છે અથવા રદ કરી સમગ્ર ખરીદ પ્રક્રિયા ફરીથી શરૂ કરી શકે છે.
	૨.૩	સદર કામગીરીની ખરીદ પ્રક્રિયા માટે નક્કી કરવામાં આવેલ સમિતિ જે કોઈપણ નિર્ણય કરશે એ આખરી ગણવામાં આવશે.

૨.૪	સદર કામગીરીની ખરીદ પ્રક્રિયામાં તકનીકી દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ ૩ (ત્રણ) કરતા ઓછી એજન્સી/પાર્ટીઓ લાયક (ક્વોલિફાય) થવા પામશે તો સદર કામગીરી માટે નક્કી કરવામાં આવેલ સમિતિ ઈચ્છે તો ગેરલાયક (ડીસ-ક્વોલિફાય) ઠરેલ એજન્સી/પાર્ટીઓના ભાવો ખોલવાનો નિર્ણય લઈ શકે છે.
૨.૫	સદર કામગીરીના સ્પર્ધાત્મક ભાવો મેળવવા અને કામગીરી ઉચ્ચ ગુણવત્તા માટે સદર કામગીરી માટે નક્કી કરવામાં આવેલ સમિતિ જે નિર્ણય કરશે એ માન્ય ગણવામાં આવશે.
૨.૬	સદર ટેન્ડર પ્રાપ્તિની છેલ્લી તારીખ પહેલાં કોઈપણ સમયે કોઈપણ કારણોસર ટેન્ડર ડોક્યુમેન્ટમાં સુધારા વધારા કે દસ્તાવેજમાં ફેરફાર કરવાની સત્તા સદર કામગીરી ખરીદ પ્રક્રિયા માટે નક્કી કરવામાં આવેલ સમિતિની રહેશે.
૨.૭	સંબંધકર્તા સર્વેને વેબસાઈટ nau.in દ્વારા સુધારાની જાણ કરવામાં આવશે. તેથી તમામ એજન્સી/પાર્ટીને nau.in વેબસાઈટ નિયમિતપણે જોવા વિનંતી કરવામાં આવે છે.
૨.૮	સદર ટેન્ડરની ટેન્ડર પ્રક્રિયા દરમિયાન કે કામગીરી માટે એજન્સી/પાર્ટીની પસંદગી બાદ અથવા તો કામગીરીના સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના કાયદાકીય પ્રશ્નો ઉપસ્થિત થવા પામશે તો તે બાબતે ન્યાયીક ક્ષેત્ર (Judicial Area) નવસારી રહેશે.
૨.૯	સાધનિક પ્રમાણ પત્રો અને વિગતો વગરનું ટેન્ડર ફોર્મ અધૂરું ગણીને તેને અમાન્ય ગણવામાં આવશે. જે બાબતે પાછળથી પાર્ટીનો કોઈ હકદાવો રહેશે નહીં.

03	દંડ (Penalty), વસુલાત અને કરારનામું.	
3.1		<p>સદર કામગીરી માટે પસંદગી પામેલ એજન્સી/પાર્ટી કોઈપણ કારણોસર જણાવેલ નિયમો, બોલીઓ અને શરતો મુજબ સર્વિસ/કામગીરી કરવામાં નિષ્ફળ નીવડે તો અત્રેની યુનિવર્સિટીમાં એ એજન્સી/પાર્ટીને કુલ ૫ (પાંચ) વર્ષ માટે બ્લેકલિસ્ટેડ કરવામાં આવશે તેમજ એજન્સી/પાર્ટીને અત્રેથી સદર કામગીરી માટે જે તે વર્ક ઓર્ડર માટે કોઈ રકમનું ચુકવણું કરવામાં આવેલ હશે તો ચૂકવેલી રકમ ઉપરાંત ૧૦ ટકા લેખે દંડ (પેનલ્ટી)ની રકમ સહિત પરત કરવાની રહેશે તેમજ સદર કામગીરી માટે જમા લેવામાં આવેલ ઇ.એમ.ડી અને સિક્યોરિટી ડિપોઝીટની રકમ ફોરફીટ કરી અત્રેની યુનિવર્સિટીમાં જમા લેવામાં આવશે.</p>
3.2		<p>સદર કામગીરી માટે મંગાવવામાં આવેલ તમામ લાયકાત અને માપદંડ માટેના આધાર પુરાવા માંથી કોઈપણ આધાર પુરાવા ખોટા સાબિત થશે તો સદર કામગીરી માટે નક્કી કરવામાં આવેલ સમિતિ ઈચ્છે તો અત્રેની યુનિવર્સિટીમાં ખોટા આધાર પુરાવા રજૂ કરનાર એજન્સી/પાર્ટીને બ્લેકલિસ્ટેડ કરવા તેમજ ઇ.એમ.ડી અને સિક્યોરિટી ડિપોઝીટની રકમ જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરી શકશે.</p>
3.3		<p>કામગીરી દરમિયાન યુનિવર્સિટીની માલ-મિલકતને કોઈપણ નુકશાન થાય તો તેની ભરપાઈ પાર્ટીએ કરવાની રહેશે તથા કામગીરી દરમિયાન કોઈ અક્સ્માત થાય તો તેની સંપૂર્ણ જવાબદારી પાર્ટીની રહેશે.</p>
3.4		<p>સદર કામગીરી માટે પસંદગી પામેલ એજન્સી/પાર્ટીએ પોતાના સ્વખર્ચે ₹૩૦૦/- (અંકે રૂપિયા ત્રણસો પુરા)ના સ્ટેમ્પ પેપર ઉપર <b>Director of Research, Navsari Agricultural University</b> સાથે (SLA) સર્વિસ લેવલ એગ્રીમેન્ટ ફરજિયાત કરવાનું રહેશે.</p>

૦૪	એજન્સી/ પાર્ટીની પસંદગી.	
	૪.૧	સદર કામગીરી માટે એજન્સી/પાર્ટીની પસંદગી માટે એવીજ એજન્સી/ પાર્ટીના ભાવ પત્રક ખોલવામાં આવશે જેના તમામ ફરજિયાત મંગાવવામાં આવેલ તકનીકી દસ્તાવેજ પૂરતા અને સાચા હશે.
	૪.૨	સદર કામગીરી માટે એજન્સી/પાર્ટીની પસંદગી ભાવોના કુલ સરવાળાના વાર્ષિક ન્યુનતમ ભાવ ઉપરથી કરવામાં આવશે.
	૪.૩	જે પાર્ટીના ભાવો માન્ય રાખવામાં આવે અને તે પાર્ટી નિયત કરવામાં આવેલ તારીખે તળાવ ખોદવાની કામગીરી શરૂ કરવામાં નિષ્ફળ જશે તો કોઇપણ કારણ આપ્યા વગર તે પાર્ટીનો કોન્ટ્રાક્ટ રદ કરી પછીના ક્રમે આવતા ઇસમને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવશે અને અર્નેસ્ટ મની ડીપોઝીટ (EMD)ની રકમ પુરેપુરી જપ્ત (forfeit) કરવામાં આવશે.
૦૫	દસ્તાવેજીકરણ	
	૫.૧	<p>સદર કામગીરીના ભાવો તેમજ જરૂરી આધારો જમા કરાવવા માટે જુદાજુદા કુલ ૩ (ત્રણ) કવર બનાવવાના રહેશે.</p> <p><u>(૧) તકનીકી દસ્તાવેજનું કવર.</u></p> <p>જેમાં સદર જાહેરાતથી માંગવામાં આવેલ તમામ આધારો જેવા કે, ટેન્ડર ફીની રસીદ અને ઇ.એમ.ડી.નો ડ્રાફ્ટ or RTGS/DBTના આધાર પુરાવા, પાનકાર્ડની ઝેરોક્ષ નકલ, અનુભવના પ્રમાણપત્રની ઝેરોક્ષ નકલ અને અન્ય સાધનિક પુરાવા સામેલ રાખવા.</p> <p><u>(૨) ભાવ પત્રક (સીલબંધ).</u></p> <p>જેમાં ફક્ત સદર કામગીરી માટેના તમામ કરવેરા સહિતના ભાવો દર્શાવતું ભાવ પત્રક સામેલ રાખવું. આ કવર સીલબંધ ન હશે તો ભાવો માન્ય રાખવામાં આવશે નહીં.</p>

		<p><u>(3) મુખ્ય કવર (સીલબંધ).</u></p> <p>જેમાં ઉપરોક્ત બન્નેવ (૧) તકનીકી દસ્તાવેજનું કવર અને (૨) ભાવ પત્રકનું સીલબંધ કવર સામેલ રાખવા.</p> <p>* મુખ્ય સીલબંધ કવર “સંશોધન નિયામકશ્રી, નવસારી કૃષિ યુનિવર્સિટી, યુનિવર્સિટી ભવન, એરૂ ચાર રસ્તા, નવસારી - ૩૯૬૪૫૦”ના સરનામે મોડામાં મોડું તા.૨૧/૦૫/૨૦૨૨ સુધીમાં કચેરી સમય દરમ્યાન મળી રહે તે રીતે પોસ્ટ/કુરીયરથી મોકલવાનું રહેશે. કવર ઉપર “<u>તળાવ ઊંડા કરવાનું ટેન્ડર ફોર્મ</u>” એમ અવશ્ય લખવાનું રહેશે. આપના ભાવો અત્રેની કચેરીને નિર્ધારિત તારીખ સુધીમાં મળે તે મુજબ મોકલી આપવાના રહેશે અન્યથા આપના ભાવો ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. (ટેન્ડર ફોર્મ રૂબરૂમાં સ્વિકારવામાં આવશે નહીં)</p>
૦૬	એજન્સી/ પાર્ટીની પસંદગી, બિલિંગ વિગતો, ચુકવણીની શરતો, કર અને અન્ય શુલ્ક.	
	૬.૧	સદર કામગીરી માટે તમામ પ્રકારના કરવેરા સહિતના ભાવો રજૂ કરવાના રહેશે.
	૬.૨	સદર કામગીરી માટે મંજૂર થયેલ ભાવો ઉપરાંત કોઈપણ પ્રકારનું ખાનગી/છુપા (હિડન) ચાર્જ, મુસાફરી ભથ્થું, લોજિંગ/બોર્ડિંગ જેવા કોઈપણ પ્રકારના વધારાના ભથ્થા/ચાર્જ ચૂકવવામાં આવશે નહીં.
	૬.૩	મંજૂર થયેલ ભાવો ઓર્ડર આપ્યાની તારીખથી ૧૨ મહિના સુધી માન્ય રહેશે.
	૬.૪	કામગીરી દરમ્યાન જો વરસાદ ચાલુ થાય અને કામગીરી શક્ય ન બને તો જેટલી કામગીરી થઈ હશે ફક્ત તેના જ નાણાનું ચુકવણું કરવામાં આવશે.
	૬.૫	સદર કામગીરીના બીલના ચૂકવણામાંથી સરકારશ્રીના નિતિ-નિયમો મુજબ કરવેરાની કપાત કરવામાં આવશે.

૬.૬	સદર કામગીરી માટે કોઈપણ પ્રકારનું અગાઉથી (એડવાન્સ) ચુકવણું કરવામાં આવશે નહીં.
૬.૭	સદર કામગીરી માટે પસંદગી પામેલ એજન્સી/પાર્ટી અન્ય કોઈ એજન્સી/પાર્ટીને સબ કોન્ટ્રાક્ટથી કામગીરી કરાવી શકશે નહીં, જેની ખાસ નોંધ લેવી.
૬.૮	યુનીવર્સિટીને <u>“સંશોધન નિયામકશ્રી, નવસારી કૃષિ યુનીવર્સિટી, નવસારી”</u> ના નામનું પાકું બીલ આપવાનું રહેશે. બીલના પેમેન્ટ બાબતે કોઈપણ કાયદાકીય પ્રશ્નો ઉપસ્થિત થાય ત્યારે સંપૂર્ણ જવાબદારી પાર્ટીની રહેશે. જરૂરીયાત ઉભી થાય ત્યારે બીલની કુલ રકમમાંથી નિયમાનુસાર TDS/GST કાપી બીલનું ચુકવણું કરવામાં આવશે.
૬.૯	માનનીય સરકારશ્રીના પ્રવર્તમાન નિયમાનુસાર જે કોઈ ટેક્સ ભરવા માટે કરવાની થતી જરૂરી કાર્યવાહી પાર્ટીએ કરેલ/કરવી જરૂરી છે. અને તેના આધાર ટેન્ડર ફોર્મ સાથે રજુ કરવાના રહેશે.
૬.૧૦	ભાવો સુવાચ્ય અક્ષરે અને છેકછાક વગર ભરવાના રહેશે તથા પાર્ટીના સહી સિક્કા યોગ્ય જગ્યાએ અને યોગ્ય રીતે થયેલ હોવા જોઈએ નહિતર આવું ટેન્ડર ફોર્મ અમાન્ય ગણવામાં આવશે.
૦૭	ટેન્ડર ફી, ઇ.એમ.ડી અને સિક્યોરિટી ડિપોઝીટની રકમ.
૭.૧	સદર કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા માટે ₹ ૧,૫૦૦/- (અંકે રૂપિયા એક હજાર પાંચસો પુરા) ટેન્ડર ફી (નોન-રિફંડેબલ) ભરવું ફરજિયાત છે.



૭.૨	<p>સદર કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા માટે ₹ ૧૫,૦૦૦/- (અંકે રૂપિયા પંદર હજાર પુરા) અર્નેસ્ટ મની ડીપોઝીટ (ઇ.એમ.ડી) (રિફંડેબલ) ભરવું ફરજિયાત છે. સદર કામગીરી માટે એજન્સી/પાર્ટીની પસંદગી થતા અને પસંદગી પામેલ એજન્સી/પાર્ટી દ્વારા વર્ક ઓર્ડર સ્વીકાર્ય બાદ ઇ.એમ.ડી ની રકમ નિતિ નિયમો મુજબ છુટી કરવામાં આવશે. જો કોઈપણ કારણો સર પસંદગી પામેલ એજન્સી/પાર્ટી દ્વારા સમય મર્યાદામાં વર્ક ઓર્ડર સ્વીકારવામાં ન આવે, ૫ (પાંચ) ટકા સિક્યોરિટી ડિપોઝીટ જમા ન કરવામાં આવે તેમજ ટેન્ડરની બોલીઓ અને શરતો મુજબ કામ કરવા તૈયાર ન થાય તો ઇ.એમ.ડી ની રકમ પરત ન કરતા જપ્ત કરવામાં આવશે.</p>
૭.૩	<p>સદર કામગીરીનો વર્ક ઓર્ડર મળ્યેથી કામગીરીની શરૂઆત કરતા પહેલા સિક્યોરિટી ડિપોઝીટ (રિફંડેબલ)ની ₹ ૨૫,૦૦૦/- (અંકે રૂપિયા પચીસ હજાર પુરા) રકમ જમા કરાવવાની રહેશે. સદર કામગીરી સંતોષકારક પૂર્ણ થતા સિક્યોરિટી ડિપોઝીટની રકમ નિતિ નિયમો મુજબ છુટી કરવામાં આવશે.</p>
૭.૪	<p>ટેન્ડર ફી, ઇ.એમ.ડી અને સિક્યોરિટી ડિપોઝીટની રકમનો ડિમાન્ડ ડ્રાફ્ટ <b><u>“Planning Officer Office of the Directorate of Research”</u></b> ના નામથી જમા કરાવવાનો રહેશે.</p> <p><b><u>Bank Details for RTGS/DBT:</u></b></p> <p><b>“Planning Officer Office of the Directorate of Research”</b></p> <p><b>State Bank of India, (NAU Campus Branch)</b></p> <p><b>Saving A/C No. – 33193752896</b></p> <p><b>IFSC Code No. – SBIN0003889</b></p>

		ટેન્ડર ફી, ઇ.એમ.ડી અને સિક્યોરિટી ડિપોઝીટની રકમ RTGS/DBTથી ટ્રાન્સફર કરવામાં આવે તો એ અંગેની જાણ <a href="mailto:dr@nau.in">dr@nau.in</a> ઉપર કરવાની રહેશે તથા ટેન્ડર સાથે DD/RTGS/DBTના આધાર પુરાવા તકનીકી દસ્તાવેજનું કવરમાં સામેલ રાખવાના રહેશે.
	૭.૫	અસફળ રહેલ પાર્ટીને તેમની અર્નેસ્ટ મનીડીપોઝીટ (EMD)ની રકમ ટેન્ડરીંગ કાર્યવાહી પુર્ણ થયે પરત કરવામાં આવશે. જ્યારે સફળ રહેલ પાર્ટી સિક્યોરિટી ડીપોઝીટ (SD) તરીકેની રકમ જમા કરાવે પછી પરત કરવામાં આવશે.

**પ્રકરણ ૦૨ ના તમામ નિયમો, બોલીઓ અને શરતો અમને માન્ય છે.**

**એજન્સી/ પાર્ટીના માલિકની સહી અને સિક્કો**

## પ્રકરણ ૦૩: એજન્સી/ પાર્ટીની માહિતી

01. Name of Agency/ Party :

---

02. Agency/ Party Registration No. :

---

03. Complete postal address :

---

04. Telephone/Mobile Number :

---

05. FAX Number (if any) :

---

06. E-mail address :

---

07. GST No. :

---

08. PAN No. :

---

09. Any other details :

---

એજન્સી/ પાર્ટીના માલિકની સહી અને સિક્કો

**પ્રકરણ ૦૪: ફરજિયાત જમા કરાવવાના આધાર પુરાવા,  
લાયકાત અને માપદંડ**

૦૧	સરકારી/સહકારી/યુનિવર્સિટીમાં તળાવ ખોદવાની કામગીરી અંગે ઓછામાં ઓછા ૨ વર્ષના અનુભવ અંગેનું પ્રમાણપત્ર અથવા આધાર રજુ કરવાના રહેશે.
૦૨	છેલ્લા ૨ વર્ષના ઇન્કમેટેક્સ રીટર્નની વિગત રજુ કરવાની રહેશે. (Assessment Year: 2021-22 & 2022-23 )
૦૩	પાર્ટીના તમામ આધાર પુરાવા જેવા કે, પાન કાર્ડ, GSTની વિગત, Address Proof તથા અન્ય ટેન્ડરના પ્રકરણ-૨ અને પ્રકરણ-૩માં જણાવેલ આધાર પુરાવા રજુ કરવાના રહેશે.

ઉક્ત તમામ લાયકાત અને માપદંડ માટેના આધાર પુરાવા અમારા દ્વારા સાચા અને યોગ્ય ખરાઈ કરી રજુ કરવામાં આવેલ છે અને જો કોઈપણ આધાર પુરાવા ખોટા સાબિત થશે તો સદર કામગીરી માટે નક્કી કરવામાં આવેલ સમિતિ જે નિર્ણય કરશે એ અમને માન્ય રહેશે.

એજન્સી/ પાર્ટીના માલિકની સહી અને સિક્કો

**પ્રકરણ ૦૫: ભાવ પત્રક (અલગથી સીલ બંધ કવરમાં જમા કરવું)**

નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના મુખ્ય કેમ્પસ ખાતે  
તળાવ ઉંડા કરવાની કામગીરી અંગેનું ભાવપત્રક

અ. નં.	કામગીરીની વિગત	ભાવો (રૂ.) (તમામ ટેક્ષ સહિતના)
૧.	નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના બાગાયત પોલીટેકનીક હસ્તકના પ્લોટ નંબર: જી-૨૮ ખાતેનું તળાવ ઊંડું કરી માટી કેમ્પસ ખાતેના માસ્ટર પ્લાન વિભાગ-એ, પ્લોટ નંબર-૧૧ અને ૧૨માં માટી પુરાણ કરવાના પ્રતિ ઘન મીટરના ભાવ (તળાવ અને પુરાણની જગ્યા વચ્ચેનું અંતર આશરે ૨.૦ કિલોમીટર છે)	

સ્થળ :

એજન્સી/ પાર્ટીના માલિકની સહી અને

તારીખ :

સિક્કો